

NILA SPACES LIMITED

NILA SPACES LIMITED
 (CIN : L45100GJ2000PLC083204)
 Registered Office: 1st Floor, Sambhaav House, Opp. Chief Justice's Bungalow, Bodakdev, Ahmedabad - 380 015.
 Phone: + 91 79 4003 681/18 Fax: + 91-79-26873922
 E-mail: secretarial@nilaspaces.com Website: www.nilaspaces.com

EXTRACTS OF STANDALONE AND CONSOLIDATED FINANCIAL RESULTS FOR THE FIRST QUARTER ENDED ON 30TH JUNE, 2022

(₹ in Lakhs)

SN	Particulars	Standalone				Consolidated			
		Quarter Ended		Year Ended		Quarter Ended		Year Ended	
		30-06-22	31-03-22	30-06-21	31-03-22	30-06-22	31-03-22	30-06-21	31-03-22
	(Refer Notes below)	Unaudited	Audited	Unaudited	Audited	Unaudited	Audited	Unaudited	Audited
1	Total Income from Operations	162.32	175.10	302.27	1,071.87	162.32	204.54	243.74	933.99
2	Net Profit/ (Loss) for the period (before Tax, Exceptional items)	37.79	(18.26)	120.54	189.02	37.86	11.43	62.01	88.69
3	Net Profit/ (Loss) for the period before tax (after Exceptional items)	37.79	(18.26)	120.54	189.02	37.86	11.43	62.01	88.69
4	Net Profit/ (Loss) for the period after tax (after Exceptional items)	23.69	(14.13)	95.65	129.02	23.46	(50.01)	56.24	(12.12)
5	Total Comprehensive Income for the period (Comprising Profit/ (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)	24.10	(14.28)	96.25	130.67	23.87	(50.16)	56.84	(10.47)
6	"Equity Share Capital (Face Value of ₹1/- per share)"	3,938.89	3,938.89	3,938.89	3,938.89	3,938.89	3,938.89	3,938.89	3,938.89
7	Other Equity (excluding Revaluation Reserve as shown in the Audited Balance Sheet)				8,766.26				7,884.36
8	Earning per share of ₹ 1/- each (from Continuing and Discontinuing Operations)								
	Basic (in ₹)	0.01	(0.00)	0.02	0.03	0.01	(0.01)	0.01	(0.00)
	Diluted (in ₹)	0.01	(0.00)	0.02	0.03	0.01	(0.01)	0.01	(0.00)

1
The above is an extract of the detailed format of Quarterly Financial Results reviewed by the Audit Committee and approved by the Board of Directors at their respective meetings held on July 19, 2022 and the same is filed with the BSE Limited and National Stock Exchange of India Limited under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of Quarterly Financial Results and Notes thereto are available on the website of Stock Exchange at www.bseindia.com and www.nseindia.com and also on the Company's website www.nilaspaces.com

Place : Ahmedabad
Date : July 19, 2022

For and on behalf of the Board of Directors
Anand B Patel
Managing Director
DIN: 07272892



Branch : Radhanpur Char Rasta,
F-51-56, First Floor, Perfect Plaza, Radhanpur Road,
Mehsana, Telephone 8980039851,
E-mail id - dudhsa@bankofbaroda.com

SALE NOTICE FOR SALE OF IMMOVABLE PROPERTIES
"APPENDIX- IV-A [See proviso to Rule 6(2) & 8(6)]"

E-Auction Sale Notice for Sale of Immovable Assets under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 read with proviso to Rule 6 (2) & 8 (6) of the Security Interest (Enforcement) Rules, 2002.
Notice is hereby given to the public in general and in particular to the Borrower (s), Mortgagor (s) and Guarantor (s) that the below described immovable property mortgaged/charged to the Secured Creditor, possession of which has been taken by the Authorised Officer of Bank of Baroda, Secured Creditor, will be sold on "As is where is", "As is what is", and "Whatever there is" basis for recovery of dues in below mentioned account/s. The details of Borrower/s / Mortgagor / Guarantor/s / Secured Asset/s / Dues/Reserve Price/e-Auction date & Time, EMD and Bid Increase Amount are mentioned below -

Sr/ Lot No.	Name & address of Borrower/s / Guarantor/ Mortgagors	Give short description of the Immovable property with known encumbrances, if any (Mortgaged by Satishkumar H Gajjar)	Total dues	Date & Time of E-auction	Reserve Price EMD and Bid Increase amount	Status of Possession (Constructive /Physical)	Property Inspection date & ime
1	Mr. Satishkumar H Gajjar	Residential house constructed on the Eastern side of land bearing plot no. 30, admeasuring 39.23 Sq. Mtr. Of land bearing Survey No. 1569/2, in scheme known as Sahjanand Park, Situated within the limits of Village-Panchot, Taluka, Mehsana, Dist - Mehsana, Gujarat - 384002	Rs. 17,24,434.91 (Rupees Seventeen Lakhs Twenty Four thousand four hundred Thirty Four and paise Ninety One Only) + interest	Auction Date: 24.08.2022 Auction Time: 02:00 PM to 06:00 PM	Reserve Price- Rs.1320000/- 2.Earnest Money Deposit (EMD)- Rs.132000/- 3.Bid Increase Amount Rs.10000/-	Physical	Inspection Date: 20-08-2022 Inspection Time: 2:00 PM to 5:00 PM
2	Mrs. Bhartiben Satish Gajjar						

For detailed terms and conditions of sale, please refer/visit to the website link <https://www.bankofbaroda.in/e-auction.htm> and <https://fbapi.in>. Also, prospective bidders may contact the Authorised officer on Tel No. N.A. Mobile 8980039851


Date: 20.07.2022
Place: Mehsana

Name Nitin Kumar
Authorised Officer Bank of Baroda.

GROW YOUR BUSINESS WITH BUSINESS STANDARD - THE SMART CHOICE TO REACH THOSE WHO MATTER!

Write to sales@bsmail.in now, for a customised solution to your business requirements

Business Standard Insight Out



DEBTS RECOVERY TRIBUNAL-II
Government of India, Ministry of Finance
3rd Floor, Bhikhubhai Chambers, Near Kochrab Ashram, Paldi, Ahmedabad-380 006.
FORM NO. 22(Earlier 62) [Regulation 36 & 37 of DRT Regulations,2015] [See Rule 52(1)(2) of the Second Schedule to the Income Tax Act, 1961] READ WITH THE RECOVERY OF DEBTS DUE TO BANK AND FINANCIAL INSTITUTIONS ACT,1993.
E-AUCTION / SALE NOTICE
THROUGH REGD. AD / DASTI / AFFIXATION / BEAT OF DRUM / PUBLICATION
RP/RC No. 15/2020 IN O.A. No. 524/2018

UNION BANK OF INDIA, Nadiad Branch, Nadiad. ...Certificate Holder Bank V/s.
MRS. NIKITA K. PATHAK & ORS.Certificate Debtors
To, C.D. No. 1 : MRS. NIKITA K. PATHAK, 2, Madhav Duplex, Opp. Rajpath Bungalows, Smruti Temple, Nigam Road, Ghodasar, Ahmedabad. C.D. No. 2 : MR. KAUSHIK B. PATHAK, 2, Madhav Duplex, Opp. Rajpath Bungalows, Smruti Temple, Nigam Road, Ghodasar, Ahmedabad.
The aforesaid CDs No. 1 to 2 have failed to pay the outstanding dues of Rs. 28,13,613.24 (Rupees Twenty Eight Lakh Thirteen Thousand Six Hundred Thirteen & Paise Twenty Four only) as on 01.05.2018 including interest in terms of judgment and decree dated 31.08.2020 passed in O.A. No. 524/2018 as per my order dated 04.07.2022 the under mentioned property (s) will be sold by public e-auction in the aforementioned matter.
The auction sale will be held through "online e-auction" Website : <https://www.drt.auctiontiger.net>

Lot No.	Description of the Property	Reserve Price	EMD (10% of Reserve Price)
1	Plot No. E/192, Karmvir Sundervan-III, Paiki Portion of R.S. No. 26 at Manjipura, Tal. Nadiad, Dist. Kheda (Gujarat) (Admeasuring area 75.00 sq. mtrs.)	Rs. 24.00 Lakh	Rs. 2.40 Lakh

Note* In respect of any claims to be received, if any, priority of payment will be decided in terms of Section 31-B of the RDB Act, 1993 (as amended in the year 2016)


EMD shall be deposited by through RTGS/NEFT in the account as per detail as under :


Beneficiary Bank Name	Beneficiary A/C No.	Branch Address	IFSC Code
Union Bank of India	311501980050000	Karmvir Tower, Mill Road, Opp. City Gymkhana Ground, Nadiad, Dist. Kheda, Gujarat-387001.	UBIN0531154

1. The bid increase amount will be Rs. 10,000/- for Lot No. 1.
2. Prospective bidders may avail online training from service provider M/s. E-Procurement Technologies Ltd. Tel Helpline No. 9265562821, 079-81200594/598/568/587/538 and Mr. Ram Sharma (M) 9978591888, Helpline E-mail : support@auctiontiger.net and for any property related queries may contact Mr. Bhavin K. Patel, Chief Manager (M) 9925245512.
3. Prospective Bidders are advised to visit website <https://www.drt.auctiontiger.net> for detailed terms & conditions and procedure of sale before submitting their bids.
4. The prospective bidders are advised to adhere payment schedule of 25% (minus EMD) immediately after fall of hammer / close of auction and 75% within 15 days from the date of Auction and if 15th day is Sunday or other Holiday, then on immediate next first bank working day. No request for extension will be entertained.
5. The properties are being put to sale on "As is where is", "As is what is" and "As is whatever" basis and prospective buyers are advised to carry out due diligence properly.
6. Schedule of auction is as under :

Inspection of Property	27.07.2022 between 11:00 am to 2:00 pm
Last date for receiving bids along with Earnest Money & uploading Documents including proof of payment made	23.08.2022 up to 5:00 pm
E-Auction	25.08.2022 between 12:00 pm to 3:00 pm (with auto extension clause of 5 minutes, till E-Auction ends)

Issued under my hand and seal of this Tribunal on this 04th July, 2022.

 Recovery Officer-I, DRT-II, Ahmedabad.




orbit exports ltd.
Regd. Office: 122, Mistry Bhavan, 2nd Floor, Dinshaw Wacha Road, Mumbai - 400 020
Ph.: 66256262; Fax: 22822031;
Email: investors@orbitexports.com; Website: www.orbitexports.com;
CIN NO.: L40300MH1983PLC030872

NOTICE
Sub.: Transfer of Equity Shares of the Company to Investor Education and Protection Fund (IEPF) Authority
This Notice is published pursuant to the provisions of Investor Education and Protection Fund Authority (Accounting, Audit, Transfer ad Refund) Rules, 2016, as amended ("the Rules").
The rules, inter alia, contain provisions for transfer of all shares in respect of which dividend has not been paid or claimed by the shareholders for seven consecutive years or more in the name of Investor Education and Protection Fund (IEPF) Authority.
Complying with the requirements set out in the Rules, the Company has communicated to the concerned shareholders individually whose shares are liable to be transferred to the IEPF Authority under the said Rules for taking appropriate action.
The Company has also uploaded full details of such shareholders and shares due for transfer to IEPF Authority on its website www.orbitexports.com. Shareholders are requested to refer to our website to verify the details of uncashed dividends and the shares liable to be transferred to the IEPF Authority.
Shareholders may note that both the unclaimed dividend and corresponding shares transferred to the IEPF Authority account including all benefits accruing on such shares, if any, can be claimed back from the IEPF Authority after following the procedure prescribed in the Rules.
The Concerned shareholders, holding shares in the physical form and whose shares are liable to be transferred to IEPF Authority, may note that the Company would be issuing new share certificate(s) in lieu of the original Share Certificate (s) held by them for the purpose of dematerialization and transfer of shares to IEPF Authority as per the Rules and upon such issue, the Original share certificate(s) which are registered in their name will stand automatically cancelled and be deemed non-negotiable. The Shareholders may further note that the details uploaded by the Company on its website should be regarded and shall be deemed adequate notice in respect of issue of new share certificate(s) by the Company for the purpose of transfer of shares to IEPF Authority pursuant to the Rules.
In case the Company does not receive any communication from the concerned shareholders by October 19, 2022, the Company shall with a view to adhering with the requirement of the Rules, dematerialize and transfer the shares to the IEPF Authority by way of corporate action by the due date as per procedure set out in the Rules.
For any queries on the above matter, shareholders are requested to contact to the Company's Registrar and Share Transfer Agent, M/s. Link Intime India Private Limited, Ms. Nayna Wakle at Unit: Orbit Exports Limited, C-101, 247 Park, 1st Floor, L.B.S. Marg, Vikhroli West, Mumbai - 400083, Tel No.: (022)49186270, Email ID: iepf.shares@linkintime.co.in.

For Orbit Exports Limited
Sd/-
Ankit Kumar Jain
Company Secretary

Place : Mumbai
Date : July 19, 2022



Branch Office: ICICI Bank Towers, Near Chakli Circle, Old Padra Road, Vadodara- 390007.


PUBLIC NOTICE - TENDER CUM AUCTION FOR SALE OF SECURED ASSET
[See proviso to rule 8(6)]
Notice for sale of immovable assets
E-Auction Sale Notice for Sale of Immovable Assets under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 read with proviso to Rule 8 (6) of the Security Interest (Enforcement) Rules, 2002.
Notice is hereby given to the public in general and in particular to the Borrower(s) and Guarantor(s) that the below described immovable property mortgaged/charged to the Secured Creditor, the physical possession of which has been taken by the Authorised Officer of ICICI Bank Limited will be sold on "As is where is", "As is what is", and "Whatever there is" basis as per the brief particulars given hereunder;

Sr. No.	Name of Borrower(s)/ Co-Borrowers/ Guarantors/ Loan Account No.	Details of the Secured asset(s) with known encumbrances, if any	Amount Outstanding	Reserve Price Earnest Money Deposit	Date and Time of Property Inspection	Date & Time of Auction
(A)	(B)	(C)	(D)	(E)	(F)	(G)
1.	Bhavneen Madhusudan Rohit (Borrower) / Jammaben Solanki (Co-borrower) Loan A/C No. LBBRD00002957799	Block No A-51, Ground Floor, Madhuvan Residency, Nr. Gokul Nagar, B/H Mahadev Temple, Village Nandesari Village, R. S. No. 6/1, Vadodara - 390024. Plot area of 328.49 Sq. Ft. Free Hold Property.	Rs. 19,51,701/- (as on July 11, 2022)	Rs. 7,80,000/- Rs. 78,000/-	August 12, 2022 From 11:00 AM To 02:00 PM	August 26, 2022 From 11:00 AM To 02:00 PM

The online auction will be conducted on website (URL Link- <https://disposalhub.com>) of our auction agency M/s NexXen Solutions Private Limited. The Mortgagors/ notice are given a last chance to pay the total dues with further interest till August 25, 2022 before 04:00 PM else this secured asset will be sold as per schedule.
The Prospective Bidder(s) must submit the Earnest Money Deposit (EMD) Demand Draft (DD) (Refer Column E) at ICICI Bank Towers, Near Chakli Circle, Old Padra Road, Vadodara- 390007 on or before August 25, 2022 before 03:00 PM and thereafter they need to submit their offer through the above mentioned website only on or before August 25, 2022 before 04:00 PM along with scan image of Bank acknowledged DD towards proof of payment of EMD. Kindly note, in case prospective bidder(s) are unable to submit their offer through the website then signed copy of tender documents may be submitted at ICICI Bank Towers, Near Chakli Circle, Old Padra Road, Vadodara-390007 on or before August 25, 2022 before 05:00 PM Earnest Money Deposit DD/PO should be from a Nationalised/Scheduled Bank in favour of "ICICI Bank Limited" payable at Vadodara.
For any further clarifications with regards to inspection, terms and conditions of the auction or submission of tenders, kindly contact ICICI Bank Limited on 7304914237/7573024297.
Please note that Marketing agencies 1. M/s NexXen Solutions Private Limited 2. Augco Assets Management Private Limited have also been engaged for facilitating the sale of this property.
The Authorised Officer reserves the right to reject any or all the bids without furnishing any further reasons.
For detailed terms and conditions of the sale, please visit www.icicibank.com/n4p4s

Date: July 20, 2022
Place: Vadodara

Authorized Officer
ICICI Bank Limited



Housing Development Finance Corporation Ltd.
HDFC House, Nr. Mithakhali Six Road, Navrangpura, Ahmedabad. Phone : (079) 66307000

DEMAND NOTICE
Under Section 13 (2) of the Securitisation And Reconstruction Of Financial Assets And Enforcement Of Security Interest Act, 2002 (Act) read with Rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002.
Whereas the undersigned being the Authorised Officer of Housing Development Finance Corporation Ltd. (HDFC Limited) under Securitisation And Reconstruction Of Financial Assets And Enforcement Of Security Interest Act, 2002 and in exercise of powers conferred under Section 13 (12) read with Rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002, issued Demand Notices under Section 13 (2) of the said Act, calling upon the Borrower(s) / Legal Heir(s) / Legal Representative(s) listed hereunder, to pay the amounts mentioned in the respective Demand Notices, within 60 days from the date of the respective Notices, as per details given below. The undersigned have, caused these Notices to be posted on the premises of the last known respective addresses of the said Borrower(s) / Legal Heir(s) / Legal Representative(s). Copies of the said Notices are available with the undersigned, and the said Borrower(s) / Legal Heir(s) / Legal Representative(s) , may, if they so desire, collect the respective copy from the undersigned on any working day during normal office hours.
In connection with the above, Notice is hereby given, once again, to the said Borrower(s) / Legal Heir(s) / Legal Representative(s) to pay to HDFC Limited, within 60 days from the date of publication of this Notice, the amounts indicated hereinbelow in their respective names, together with further interest @ 18% p.a. as detailed in the said Demand Notices from the respective dates mentioned below in column (c) till the date of payment and / or realisation, read with the loan agreement and other documents/writings, if any, executed by the said Borrower(s). As security for due repayment of the loan, the following Secured Asset(s) have been mortgaged to HDFC Limited by the said Borrower (s) respectively:
Borrower(s) / Legal Heir(s) / Legal Representative(s) attention is/are invited to the provisions of sub-section (8) of section 13 of the Act, in respect of time available to redeem the secured asset/s.


Sr. No.	Name of Borrower(s) / Guarantor(s)/Legal Heir(s) / Legal Representative(s)	Total Outstanding Dues	Date of Demand Notice	Description of Secured Asset(s) / Immoveable Property (ies)
(a)	(b)	(c)	(d)	(e)
1	Wife/Son/Husband/Daughter of MR. VIJENDRASINGH S. CHOUDHARY [Since Deceased] And other known and unknown Legal Heir(s), Legal Representative(s), Successors and Assigns of MR. VIJENDRASINGH S. CHOUDHARY [Since Deceased] (Borrower) Loan A/c No. 603002657	Rs. 8,87,632/- as on 31 st May, 2022*	08 July, 2022	FLAT NO.-F/304, 3RD FLOOR, PLAN-2ND FLOOR, SATKAR HOMES-BLOCK-F, R. S. 563/15 + 563/19, FP-49/3 + 45/4, TPS-58, B/H SHREERAM RESIDENCY, NAROL ASLALI ROAD, NAROL, AHMEDABAD-382405.
2	MR. HARSHAD PUJARA (Borrower) MRS. MANISHA PUJARA (Co-Borrower) Loan A/c No. 631480717, 637833768 And 632776266	Rs. 5,48,658/-, Rs. 63,012/- And Rs. 39,819/- Respectively as on 31 st May, 2022*	08 July, 2022	HOUSE-553, PLOT-553, S. NO.-18, COLONY RAVECHI NAGAR, VILLAGE MEGHPAR KUMBHARDI, ANJAR, GANDHIDHAM-370110.
3	MR. DILIPSINH AMARSINH ZALA (Borrower) MRS. ASMEETABA DILIPSINH ZALA (Co-Borrower) Loan A/c No. 619160127 And 619159844	Rs. 14,74,312/- And Rs. 1,51,664/- Respectively as on 31 st May, 2022*	08 July, 2022	1ST FLOOR, UNIT-OFFICE-1, MADHUBAN MALL, G-WING UNIT-02, S. NO. 981 PAKI-2, G-WING, OPP. SWAMI VIVEKANAND HIGH SCHOOL, KUTCH-370110.
4	MR. PRAMILKUMAR CHATURVEDI (Borrower) MRS. NITABAHEN PRAMILKUMAR CHATURVEDI (Co-Borrower) Loan A/c No. 651627901 And 650267968	Rs. 96,846/- And Rs. 41,02,679/- Respectively as on 31 st May, 2022*	08 July, 2022	UNIT-105, 1ST FLOOR, SHYAM ENCLAVE-SHOPS, S. NO. 959, TPS-2, FP-62, SHREE RAM CHOWK, ST. MERRY TO BAPA SITARAM CHOWK ROAD, NAVA NARODA, AHMEDABAD-389230.
5	MR. DINESH PRASAD SHARMA (Borrower) MRS. SANDHYA DINESH SHARMA (Co-Borrower) Loan A/c No. 631662333 And 627036344	Rs. 30,844/- And Rs. 13,30,233/- Respectively as on 31 st May, 2022*	08 July, 2022	7TH FLOOR, UNIT-A/701, PLATINUM ELEGANCE BLOCK-A, S. NO. 56/3, TPS-73, FP NO.-25/3, NEAR SHRIFAL ENCLAVE, HATHIJAN CIRCLE CROSS ROAD, S. P. RING ROAD, AHMEDABAD-382445.
6	MR. VIKRANT PUROHIT (Borrower) Loan A/c No. 606035513, 628041550 And 620601466	Rs. 10,89,901/-, Rs. 4,52,547/- And Rs. 5,31,485/- Respectively as on 31 st May, 2022*	08 July, 2022	FLAT NO.-A/303, 3RD FLOOR, VRUNDAVAN GREENS, S. NO. 754/43, NR. SAHJANAND AVENUE, VEJALPUR, AHMEDABAD-389340.
7	MR. DEEPAKKUMAR TEKRIWAL (Borrower) MRS. MAYA DEVI TEKRIWAL (Co-Borrower) Loan A/c No. 644839854, 646455270 And 644839885	Rs. 14,14,872/-, Rs. 65,708/- And Rs. 18,48,237/- Respectively as on 31 st May, 2022*	08 July, 2022	FLAT-B/702, 7TH FLOOR, PARISHKAAR BLOCK-B, S. NO. FP-31, TP-7, SP-2, ARVIND AVENUE, KHOKHARA CIRCLE, MANINAGAR EAST, MANINAGAR, AHMEDABAD-380008.
8	MR. JIGNESHBHAI ANILBHAI OZA (Borrower) MRS. BHAKTIBEN JIGNESHBHAI OZA (Co-Borrower) Loan A/c No. 643496434 And 643149873	Rs. 2,18,266/- And Rs. 24,67,989/- Respectively as on 31 st May, 2022*	08 July, 2022	FLAT-D/303, 3RD FLOOR, SAHJANAND GALAXY-BLOCK-D, PLOT F.P. NO.-173, S. NO. R. S. NO. 93, OPP. SWAMINARAYAN RESIDENCY-2, NR. DEVARSH DIVINE, RAJODA ROAD, BAVLA, AHMEDABAD-382220.

*with further interest @ 18% p.a. as applicable, incidental expenses, costs, charges etc incurred till the date of payment and / or realization.
If the said Borrowers shall fail to make payment to HDFC Limited as aforesaid, then HDFC Limited shall proceed against the above Secured Asset(s) / Immoveable Property (ies) under Section 13 (4) of the said Act and the applicable Rules entirely at the risk of the said Borrower(s) / Legal Heir(s) / Legal Representative(s) as to the costs and consequences.
The said Borrower (s) / Legal Heir(s) / Legal Representative(s) are prohibited under the said Act to transfer the aforesaid Secured Asset (s) / Immoveable Property (ies), whether by way of sale, lease or otherwise without the prior written consent of HDFC Limited. Any person who contravenes or abets contravention of the provisions of the Act or Rules made thereunder shall be liable for imprisonment and/or penalty as provided under the Act.

Date : 19-07-2022
Place : Ahmedabad

For Housing Development Finance Corporation Ltd.
Sd/-
Authorized Officer

Regd. Office: Ramon House, H T Parekh Marg, 169, Backbay Reclamation, Churchgate, Mumbai- 400020.
Corporate Identity Number : CIN : L70100MH977PLC018916. E-mail : customer.service@hdfc.com, Website : www.hdfc.com



INTEGRA ENGINEERING INDIA LIMITED
CIN : L29199GJ1981PLC028741
Regd. Office : Chandrapura Village, Tal. Halol-389 350, Dist. Panchmahals, Gujarat.
Tel. No. : +91 90999 18471.
Email ID : info@integraengineering.in Website : www.integraengineering.in


Statement of Unaudited Consolidated Financial Results for the Quarter ended 30th June, 2022

		(₹ in Lacs)	
Sr. No.	Particulars	Quarter ended 30.06.2022	Quarter ended 30.06.2021
1	Total Income from operations	2,774.46	1,975.81
2	Net Profit / (Loss) for the period before Tax	213.14	306.04
3	Net Profit / (Loss) for the period after Tax	148.81	216.72
4	Total Comprehensive Income for the period	152.11	217.26
5	Equity Share Capital	342.45	342.45
6	Other Equity	-	-
7	Earnings per share of ₹ 1/- each		
(1) Basic		0.43	0.63
(2) Diluted		0.43	0.63

Notes : 1. The above is an extract of the detailed format of Quarterly / Year ended Financial Results filed with the Stock Exchange under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly / Year ended Financial Results are available on the Company's website (www.integraengineering.in) and on Stock Exchange website (www.bseindia.com).

For INTEGRA Engineering India Limited
Shalin Sunandan Divatia
Director

Place : Mumbai
Date : 19.07.2022



INTEGRA ENGINEERING INDIA LIMITED
CIN : L29199GJ1981PLC028741
Regd. Office : Chandrapura Village, Tal. Halol-389 350, Dist. Panchmahals, Gujarat.
Tel. No. : +91 90999 18471.
Email ID : info@integraengineering.in Website : www.integraengineering.in

Statement of Unaudited Standalone Financial Results for the Quarter ended 30th June, 2022

		(₹ in Lacs)	
Sr. No.	Particulars	Quarter ended 30.06.2022	Quarter ended 30.06.2021
1	Total income from operations	2,774.46	1,975.81
2	Net Profit / (Loss) for the period before Tax	213.14	306.04
3	Net Profit / (Loss) for the period after Tax	148.81	216.72
4	Total Comprehensive Income for the period	152.11	217.26
5	Equity Share Capital	342.45	342.45
6	Other Equity	-	-
7	Earnings per share of ₹ 1/- each		
(1) Basic		0.43	0.63
(2) Diluted		0.43	0.63

Notes : 1. The above is an extract of the detailed format of Quarterly / Year ended Financial Results filed with the Stock Exchange under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly / Year ended Financial Results are available on the Company's website (www.integraengineering.in) and on Stock Exchange website (www.bseindia.com).

For INTEGRA Engineering India Limited
Shalin Sunandan Divatia
Director

Place : Mumbai
Date : 19.07.2022

204.54	263.34	923.99
(7.43)	62.62	68.69
9.43	62.63	68.69
(56.03)	58.28	(12.12)
(56.38)	58.88	(10.47)
3,336.89	3,336.89	3,336.89
		7,884.36
(7.07)	0.07	61.06
(7.07)	0.07	61.06

Directors at their respective meetings held on
 (i)ing Obligations and Disclosure Requirements and
www.bseindia.com and www.secdisclosure.com

on behalf of the Board of Directors
and Panel
aging Director
67272492